https://archive.org/details/bk923/page/n0/mode/1up

2012-12-15 -Patidar Pragati -Mumbai Zone Aheval (923)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

MUMBAI PATIDAR PRAGATI (MONTHLY)

|| શ્રી ઉમિયાય નમઃ ||
|| શ્રી ગણેશાય નમઃ ||

મુંબઈ પાટીદાર પ્રગતિ

વાર્ષિક લવાજમ રૂા. ૧૨/-

શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ (મુંબઈ) નું મુખપત્ર

* સ્થાપના : ૧૯/૧૦/૧૯૯૯ • સંચાલન : શ્રી પાટીદાર યુવક મંડળ (મુંબઈ) • મુખપત્ર સમિતિ • તંત્રી : શ્રી નારાયણ વિ. ભગત *

Shree Kutchhi Kadva Patidar Gnyati Trust Fund (Mumbai), Patidar Wadi, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai - 400 086.

વર્ષ : ૧૩ ★ અંક ૧૩૩ ❒ RNI No. : MAHGUJ / 2010 / 32199 ❒ Posting No. MH/MR/North East / 258 / 2010-12 • તા. ૧૫/૧૨/૨૦૧૨ • પાના - ૪

સમાજે આપણા માટે શું કર્યું ? તેના બદલે આપણે સમાજ માટે શું કર્યું ? તેવું વિચારીએ...

તંત્રી સ્થાનેથી...

સત્તાનો મોહ અને અહમ વ્યક્તિના માનવીય મૂલ્યોનું પતન કરે છે.

હાલના સમયમાં કેટલાકલોકો સત્તાની ખુરશી માટે આંધળી દોટ મકીને જીવન જીવી રહ્યા હોય છે. માનવીય મૂલ્યોને ત્યાગીને આત્માના અવાજને દાબીને ધર્મની સાચી ભાવનાને અવગણીને સત્તા અને ખુરશી માટે ક્યારેય ન જોયા હોય તેવા ખેલ ખેલી રહેતા જોવા મળે છે. આજે તો ધાર્મિક ક્ષેત્રે પણ લોકોમાં પાછલા બારણેથી રાજનીતી ચાલતી હોય છે. ત્યાં પણ સત્તા માટે આમને સામને કાવાદાવા રમાતા હોય છે. પોતાનાથી કોઈ મોટો ન હોઈ શકે તેવી નિમ્ન પ્રકારની માણસની વૃતી જ કામ કરી રહેલ છે. કેટલાક તો એમ કહેતા હોય કે આપણને કોઈ સત્તા કે હોદાની ખેવના નથી પણ મનમાં ઉચ્ચ હોદા માટે સત્તાની ભૂખ અને રાજનીતીની લાલચા રમતી જ હોય છે. આજેતો સંત સાધુઓના ચિત્તમાંથી પણ આશ્રમોમાં રાજનીતી જેવી પ્રવૃતી જલ્દીથી જતી ન હોય તો સામાન્ય માણસનું શું કહેવું ? સેવા પણ હવે ભાગ્યેજ શુદ્ધ રહી છે. બાકી સેવાની પાછળ સત્તાની ભૂખ અને ખુરશીની લાલસા છુપાયેલી હોય છે. સરળ અને સજ્જન વ્યક્તિને પણ સત્તા ભ્રષ્ટ કરે છે. ઉચ્ચ હોદા અને સત્તા સુધી પહોંચવાની યાત્રા એટલી બધી અટપટી હોય છે કે માણસની અંદરના માનવીય મૂલ્ય તેમાં ખોવાઈ જાય છે અને દબા રહેલાં દૂષણો બહાર આવે છે. અહંકાર અને લોભ એ દૂષણોનું મૂળ છે. સત્તાનો મોહ અને અહમ વ્યક્તિના માનવીય મૂલ્યોનું પતન કરે છે.

નારાયણ વિશ્રામ ભગત (સુરાણી)
- માનદતંત્રી

શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઈ) દ્વારા યોજાએલ સ્નેહમિલન સમારોહ

શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઈ)ની તૃતીય કારોબારીનું આઠમું સ્નેહમિલન તા. ૨૫-૧૧-૨૦૧૨ના રવિવારના બપોરના ૩.૦૦ કલાકે ઘાટકોપર પાટીદાર વાડીમાં પ્રમુખ શ્રી શાંતિભાઈ લાલજી ઘોળુના અધ્યક્ષ સ્થાને મળેલ હતુ.

સૌ પ્રથમ મહામંત્રી શ્રી વસંત રવજી પોકારે મા ઉમિયાની જય બોલાવી આવેલ સર્વનું હાર્દિક સ્વાગત કરેલ.

ત્યારબાદ મહામંત્રી વસંત રવજી પોકારે ઘાટકોપર સમાજના પ્રમુખ શ્રી શાંતિભાઈ ઘોળુ, ઉપપ્રમુખ હરિભાઈ પારસીયા તેમજ બીજા ઉપપ્રમુખ નવિનભાઈ ઘોળુ, મહામંત્રી વસંત પોકાર તેમજ મુંબઈ ટ્રસ્ટ ફંડના ચેરમેન શ્રી વિશનજીભાઈ માવાણી, મુંબઈ ઝોનના પ્રમુખ શ્રી છગનભાઈ પોકાર, ઘાટકોપર યુવક મંડળના પ્રમુખ વિજય સેંઘાણી, ઘાટકોપર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી દિપીકાબેન વેલાણી એમ સર્વને મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ અને તેમના શુભ હસ્તે મા ઉમિયાની છબી પાસે દિપ પ્રાગટ્ય કરીને મહિલા મંડળની બહેનો દ્વારા ઉમિયામાની આરતી ગાઈને આજના સ્નેહ મિલનની સભાની શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ મહામંત્રી વસંત પોકારે આજની સભાના એજન્ડા વાંચી સંભળાવેલ.

૧. જેમાં એજન્ડાના ફળ સ્વરૂપે પ્રથમ ઉપપ્રમુખ નવિનભાઈ ઘોળુએ સ્વાગત પ્રવચન કરેલ.
૨. ત્યારબાદ ગત મિટીંગની મિનીટસનું વાંચન મંત્રી નરસિંહભાઈ સેંઘાણીએ કરેલ.
૩. આવક-જાવકનો હિસાબ સહ-ખજાનચી પ્રફુલભાઈ નાકરાણીએ આપેલ.

અનુસંધાન ૨જા પાને...

શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ દ્વારા લાભ પાંચમના નૂતનવર્ષ નિમીત્તે ઉજવાયેલ ભવ્ય કાર્યક્રમ



શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ, મુંબઈ ઘાટકોપર પાટીદાર વાડીમાં સં. ૨૦૬૯ના લાભપાંચમના નવા વર્ષે ઉજવાયેલ કાર્યક્રમમાં શરૂઆત્મા મેને. ટ્રસ્ટી શ્રી શાંતીભાઈ ઘોળુંએ સ્થાનગ્રહણ કરાવેલ અને ત્યારબાદ ટ્રસ્ટીશ્રી શાંતીલાલ ભીમાણી સ્નેહમીલનનું સંચાલન કરવા માઈકની સોપણી કરી.

જેમાં મંચ ઉપર ચેરમેન શ્રી વિસનજી માવાણી, વા.ચેરમેન જયંતિલાલ પરવાડીયા, મેને. ટ્રસ્ટી શ્રી શાંતિલાલ ઘોળું, વા.મે.ટ્રસ્ટી નવીન પરવાડીયા, ટ્રસ્ટીશ્રીઓ શામજી નાકરાણી, શાંતીલાલ ભીમાણી, ચંદુલાલ નાકરાણી, હંસરાજ વાસાણી, અંબાલાલ ચૌહાણ, ઉમેશ નાથાણી, મહેશ વેલાણી, હીરાલાલ અમૃતિયા, રમણીકલાલ પોકાર, યુવક મંડળ પ્રમુખ હિતેશ રામયાણી, મહીલા મંડળ પ્રમુખ રશ્મિબેન ચૌહાણ અને મુંબઈ ઝોનના પ્રમુખ છગનભાઈ પોકાર મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ.

ત્યારબાદ ચેરમેન શ્રી વિસનજી માવાણી અને સર્વે ટ્રસ્ટીશ્રીઓ, યુવક મંડળ પ્રમુખ, મહિલા મંડળ પ્રમુખ, મુંબઈ ઝોન પ્રમુખએ ઉમીયા માતાજીની છબી પાસે દીપ પ્રાગટ્ય કરેલ અને બહેનો દ્વારા માં ઉમિયાની આરતી ગાઈ કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ.

સંવત ૨૦૬૯ના નવા વર્ષ માટે સમાજના વડીલો, બહેનોએ નૂતન વર્ષના અભિનંદન પાઠવેલ સાથે મુંબઈ ટ્રસ્ટ ફંડની એકતા જળવાઈ રહે એવા શુભ મંતવ્યો પાઠવેલ.

ત્યારબાદ પ.પૂ. સ્વામી અભયાનંદ સરસ્વતી પધારેલ અને એનું ભવ્ય સ્વાગત કરેલ અને સ્વામીજીને વ્યાસપીઠ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ અને તેના ઉપદેશમાં ''જીવન સાફલ્ય''ના વિષય ઉપર ઉપદેશ અને નવા વર્ષની શુભ કામના આપેલ.

મુંબઈ ટ્રસ્ટ ફંડ સમુહલગ્ન સમિતિ દ્વારા ૫૩માં સમુહલગ્નમાં જોડાયેલ નવયુગલોને કન્યાને કન્યાદાન અર્પણ કરવામાં આવેલ.

ત્યારબાદ કન્યા અમે વરપક્ષમાંથી પૂછવામાં આવ્યું કે આ સમુહલગ્નમાં તમારો મત આપો તો નવયુગલોમાંથી નવયુગલોએ જણાવેલ કે આ લગ્નોમાં અમો ઘરે પણ આ સગવડ ન આપી શકીએ એવી સગવડ અમોને પૂરી પાડેલ. આટલું કન્યાદાન કદાચ ભારતમાં વધારેમાં વધારે મુંબઈમાં મુંબઈ ટ્રસ્ટફંડ સમુહ લગ્રન સમિતિ દ્વારા આપવામાં આવે છે અને નવયુગલોઅ સમુહલગ્ન સમિતિને આર્શિવાદ આપેલ.

અંતમાં ચેરમેન શ્રી વિસનજી માવાણીએ જ્ઞાતિને નૂતનવર્ષના અભિનંદન આપેલ અને જણાવેલ કે મુંબઈ ટ્રસ્ટ ફંડને કોઈપણ જાતની તકલીફ નહીં પડે અમે તેમા વધારેમાં વધારે વિકાસ થશે એવી ખાત્રી આપેલ અને ટ્રસ્ટ ફંડનો વિકાસ સારામાં સારો કરીશું અવી ખાત્રી આપેલ.

અંતમાં આભાર દર્શન ટ્રસ્ટી શ્રી શાંતિલાલ ભીમાણીએ જ્ઞાતિના વડીલો આ કાર્યક્રમમાં કામ કરનારા ફોટોગ્રાફર, વીડીયો ગ્રાફર, રસોઈ બનાવનાર વિકાશ કેટરર્સ અને આ કાર્યક્રમમાં સહયોગ આપનાર નાના મોટા સર્વેનો આભાર વ્યક્ત કરેલ અને સૌ જ્ઞાતિજનોએ નૂતનવર્ષ નીમીત્તે રાખેલ મહાપ્રસાદ લેતા જવાનું જણાવેલ અંતે સર્વે સાથે રાષ્ટ્રગીત ગાઈ સભાને પૂર્ણ જાહેર કરેલ.

લી. શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ (મુંબઈ)

વ્યક્તિનો પરિચય ચહેરાથી થાય છે, પણ એની ઓળખ વાણીથી થાય છે.

realpatidar.com

https://archive.org/details/bk923/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 3.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk923/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 12:06:14 +05'30'

Real Patidar
Unravel Truth

See Page 3

realpatidar.com

MUMBAI PATIDAR PRAGATI (MONTHLY)

|| શ્રી ઉમિયાય નમઃ ||
|| શ્રી ગણેશાય નમઃ ||

મુંબઈ પાટીદાર પ્રગતિ

વાર્ષિક લવાજમ રૂા. ૧૨/-

શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ (મુંબઈ) નું મુખપત્ર

* સ્થાપના : ૧૯/૧૦/૧૯૯૯ • સંચાલન : શ્રી પાટીદાર યુવક મંડળ (મુંબઈ) • મુખપત્ર સમિતિ • તંત્રી : શ્રી નારાયણ વિ. ભગત *

Shree Kutchhi Kadva Patidar Gnyati Trust Fund (Mumbai), Patidar Wadi, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai - 400 086.

વર્ષ : ૧૩ ★ અંક ૧૩૩ ❒ RNI No. : MAHGUJ / 2010 / 32199 ❒ Posting No. MH/MR/North East / 258 / 2010-12 • તા. ૧૫/૧૨/૨૦૧૨ • પાના - ૪

સમાજે આપણા માટે શું કર્યું ? તેના બદલે આપણે સમાજ માટે શું કર્યું ? તેવું વિચારીએ...

તંત્રી સ્થાનેથી...

સત્તાનો મોહ અને અહમ વ્યક્તિના માનવીય મૂલ્યોનું પતન કરે છે.

હાલના સમયમાં કેટલાકલોકો સત્તાની ખુરશી માટે આંધળી દોટ મકીને જીવન જીવી રહ્યા હોય છે. માનવીય મૂલ્યોને ત્યાગીને આત્માના અવાજને દાબીને ધર્મની સાચી ભાવનાને અવગણીને સત્તા અને ખુરશી માટે કયારેય ન જોયા હોય તેવા ખેલ ખેલી રહેતા જોવા મળે છે. આજે તો ધાર્મિક ક્ષેત્રે પણ લોકોમાં પાછલા બારણેથી રાજનીતી ચાલતી હોય છે. ત્યાં પણ સત્તા માટે આમને સામને કાવાદાવા રમાતા હોય છે. પોતાનાથી કોઈ મોટો ન હોઈ શકે તેવી નિમ્ન પ્રકારની માણસની વૃતી જ કામ કરી રહેલ છે. કેટલાક તો એમ કહેતા હોય કે આપણને કોઈ સત્તા કે હોદાની ખેવના નથી પણ મનમાં ઉચ્ચ હોદા માટે સત્તાની ભૂખ અને રાજનીતીની લાલચા રમતી જ હોય છે. આજેતો સંત સાધુઓના ચિત્તમાંથી પણ આશ્રમોમાં રાજનીતી જેવી પ્રવૃતી જલ્દીથી જતી ન હોય તો સામાન્ય માણસનું શું કહેવું ? સેવા પણ હવે ભાગ્યેજ શુદ્ધ રહી છે. બાકી સેવાની પાછળ સત્તાની ભૂખ અને ખુરશીની લાલસા છુપાયેલી હોય છે. સરળ અને સજ્જન વ્યક્તિને પણ સત્તા ભ્રષ્ટ કરે છે. ઉચ્ચ હોદા અને સત્તા સુધી પહોંચવાની યાત્રા એટલી બધી અટપટી હોય છે કે માણસની અંદરના માનવીય મૂલ્ય તેમાં ખોવાઈ જાય છે અને દબા રહેલાં દૂષણો બહાર આવે છે. અહંકાર અને લોભ એ દૂષણોનું મૂળ છે. સત્તાનો મોહ અને અહમ વ્યક્તિના માનવીય મૂલ્યોનું પતન કરે છે.

નારાયણ વિશ્રામ ભગત (સુરાણી)
- માનદતંત્રી

શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઈ) દ્વારા યોજાએલ સ્નેહમિલન સમારોહ

શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઈ)ની તૃતીય કારોબારીનું આઠમું સ્નેહમિલન તા. ૨૫-૧૧-૨૦૧૨ના રવિવારના બપોરના ૩.૦૦ કલાકે ઘાટકોપર પાટીદાર વાડીમાં પ્રમુખ શ્રી શાંતિભાઈ લાલજી ઘોળુના અધ્યક્ષ સ્થાને મળેલ હતુ.

સૌ પ્રથમ મહામંત્રી શ્રી વસંત રવજી પોકારે મા ઉમિયાની જય બોલાવી આવેલ સર્વનું હાર્દિક સ્વાગત કરેલ.

ત્યારબાદ મહામંત્રી વસંત રવજી પોકારે ઘાટકોપર સમાજના પ્રમુખ શ્રી શાંતિભાઈ ઘોળુ, ઉપપ્રમુખ હરિભાઈ પારસીયા તેમજ બીજા ઉપપ્રમુખ નવિનભાઈ ઘોળુ, મહામંત્રી વસંત પોકાર તેમજ મુંબઈ ટ્રસ્ટ ફંડના ચેરમેન શ્રી વિશનજીભાઈ માવાણી, મુંબઈ ઝોનના પ્રમુખ શ્રી છગનભાઈ પોકાર, ઘાટકોપર યુવક મંડળના પ્રમુખ વિજય સેંઘાણી, ઘાટકોપર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી દિપીકાબેન વેલાણી એમ સર્વને મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ અને તેમના શુભ હસ્તે મા ઉમિયાની છબી પાસે દિપ પ્રાગટ્ય કરીને મહિલા મંડળની બહેનો દ્વારા ઉમિયામાની આરતી ગાઈને આજના સ્નેહ મિલનની સભાની શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ મહામંત્રી વસંત પોકારે આજની સભાના એજન્ડા વાંચી સંભળાવેલ.

૧. જેમાં એજન્ડાના ફળ સ્વરૂપે પ્રથમ ઉપપ્રમુખ નવિનભાઈ ઘોળુએ સ્વાગત પ્રવચન કરેલ.
૨. ત્યારબાદ ગત મિટીંગની મિનીટસનું વાંચન મંત્રી નરસિંહભાઈ સેંઘાણીએ કરેલ.
3. આવક-જાવકનો હિસાબ સહ-ખજાનચી પ્રફુલભાઈ નાકરાણીએ આપેલ.

અનુસંધાન ૨જા પાને...

શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ દ્વારા લાભ પાંચમના નૂતનવર્ષ નિમીત્તે ઉજવાયેલ ભવ્ય કાર્યક્રમ



શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ, મુંબઈ ઘાટકોપર પાટીદાર વાડીમાં સં. ૨૦૬૯ના લાભપાંચમના નવા વર્ષે ઉજવાયેલ કાર્યક્રમમાં શરૂઆત્મા મેને. ટ્રસ્ટી શ્રી શાંતીભાઈ ઘોળુંએ સ્થાનગ્રહણ કરાવેલ અને ત્યારબાદ ટ્રસ્ટીશ્રી શાંતીલાલ ભીમાણી સ્નેહમીલનનું સંચાલન કરવા માઈકની સોપણી કરી.

જેમાં મંચ ઉપર ચેરમેન શ્રી વિસનજી માવાણી, વા.ચેરમેન જયંતિલાલ પરવાડીયા, મેને. ટ્રસ્ટી શ્રી શાંતિલાલ ઘોળું, વા.મે.ટ્રસ્ટી નવીન પરવાડીયા, ટ્રસ્ટીશ્રીઓ શામજી નાકરાણી, શાંતીલાલ ભીમાણી, ચંદુલાલ નાકરાણી, હંસરાજ વાસાણી, અંબાલાલ ચૌહાણ, ઉમેશ નાથાણી, મહેશ વેલાણી, હીરાલાલ અમૃતિયા, રમણીકલાલ પોકાર, યુવક મંડળ પ્રમુખ હિતેશ રામયાણી, મહીલા મંડળ પ્રમુખ રશ્મિબેન ચૌહાણ અને મુંબઈ ઝોનના પ્રમુખ છગનભાઈ પોકાર મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ.

ત્યારબાદ ચેરમેન શ્રી વિસનજી માવાણી અને સર્વે ટ્રસ્ટીશ્રીઓ, યુવક મંડળ પ્રમુખ, મહિલા મંડળ પ્રમુખ, મુંબઈ ઝોન પ્રમુખએ ઉમીયા માતાજીની છબી પાસે દીપ પ્રાગટ્ય કરેલ અને બહેનો દ્વારા માં ઉમિયાની આરતી ગાઈ કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ.

સંવત ૨૦૬૯ના નવા વર્ષ માટે સમાજના વડીલો, બહેનોએ નૂતન વર્ષના અભિનંદન પાઠવેલ સાથે મુંબઈ ટ્રસ્ટ ફંડની એકતા જળવાઈ રહે એવા શુભ મંતવ્યો પાઠવેલ.

ત્યારબાદ પ.પૂ. સ્વામી અભયાનંદ સરસ્વતી પધારેલ અને એનું ભવ્ય સ્વાગત કરેલ અને સ્વામીજીને વ્યાસપીઠ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ અને તેના ઉપદેશમાં ''જીવન સાફલ્ય''ના વિષય ઉપર ઉપદેશ અને નવા વર્ષની શુભ કામના આપેલ.

મુંબઈ ટ્રસ્ટ ફંડ સમુહલગ્ન સમિતિ દ્વારા ૫૩માં સમુહલગ્નમાં જોડાયેલ નવયુગલોને કન્યાને કન્યાદાન અર્પણ કરવામાં આવેલ.

ત્યારબાદ કન્યા અમે વરપક્ષમાંથી પૂછવામાં આવ્યું કે આ સમુહલગ્નમાં તમારો મત આપો તો નવયુગલોમાંથી નવયુગલોએ જણાવેલ કે આ લગ્નોમાં અમો ઘરે પણ આ સગવડ ન આપી શકીએ એવી સગવડ અમોને પૂરી પાડેલ. આટલું કન્યાદાન કદાચ ભારતમાં વધારેમાં વધારે મુંબઈમાં મુંબઈ ટ્રસ્ટફંડ સમુહ લગ્રન સમિતિ દ્વારા આપવામાં આવે છે અને નવયુગલોઅ સમુહલગ્ન સમિતિને આર્શિવાદ આપેલ.

અંતમાં ચેરમેન શ્રી વિસનજી માવાણીએ જ્ઞાતિને નૂતનવર્ષના અભિનંદન આપેલ અને જણાવેલ કે મુંબઈ ટ્રસ્ટ ફંડને કોઈપણ જાતની તકલીફ નહીં પડે અમે તેમા વધારેમાં વધારે વિકાસ થશે એવી ખાત્રી આપેલ અને ટ્રસ્ટ ફંડનો વિકાસ સારામાં સારો કરીશું અવી ખાત્રી આપેલ.

અંતમાં આભાર દર્શન ટ્રસ્ટી શ્રી શાંતિલાલ ભીમાણીએ જ્ઞાતિના વડીલો આ કાર્યક્રમમાં કામ કરનારા ફોટોગ્રાફર, વીડીયો ગ્રાફર, રસોઈ બનાવનાર વિકાશ કેટરર્સ અને આ કાર્યક્રમમાં સહયોગ આપનાર નાના મોટા સર્વેનો આભાર વ્યક્ત કરેલ અને સૌ જ્ઞાતિજનોએ નૂતનવર્ષ નીમીત્તે રાખેલ મહાપ્રસાદ લેતા જવાનું જણાવેલ અંતે સર્વે સાથે રાષ્ટ્રગીત ગાઈ સભાને પૂર્ણ જાહેર કરેલ.

લી. શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ (મુંબઈ)

વ્યક્તિનો પરિચય ચહેરાથી થાય છે, પણ એની ઓળખ વાણીથી થાય છે.

realpatidar.com

https://archive.org/details/bk923/page/n3/mode/1up

2012-12-15 -Patidar Pragati -Mumbai Zone Aheval (923)

પહેલા પાનાથી ચાલુ...

૪. વાર્ષિક અહેવાલ ઉપપ્રમુખ હરિભાઈ પારસીયાએ આપેલ.

૫. ઓપન મંચનું સંચાલન કા.સભ્ય પ્રકાશ માવાણીએ કરેલ.

આ પ્રમાણે સમાજના હોદેદારો, સભ્યો દ્વારા આજના કાર્યક્રમ તેમજ ગતિવીધીનો ચિતાર આપવામાં આવેલ. ત્યારબાદ યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

ત્યારબાદ સમાજના ભાઈ-બહેનો દ્વારા પોત પોતાના મંતવ્ય આપવામાં આવ્યા હતા. જેમાં નીચેના સભ્યોએ પોતાના મંતવ્ય આપેલ હતા.

(૧) મહેન્દ્ર જીવરાજ સેંઘાણી, (૨) ભગવાનજીભાઈ સાંખલા, (૩) ઈન્દુબેન ઘોળુ, (૪) શામજી હીરજી રંગાણી, (૫) લધા વિશ્રામ પોકાર, (૬) ભાવનાબેન માકાણી, (૭) લાલજીભાઈ પોકાર, (૮) મોહનભાઈ પોકર (કુરબઈ), (૯) છગનભાઈ રામજીયાણી, (૧૦) છગનભાઈ પોકાર, (૧૧) ઘાટકોપર યુવક મંડળ પ્રમુખ-વિજય સેંઘાણી, (૧૨) જીગ્નેશ ચૌહાણ, (૧૩) દીપીકાબેન વેલાણી, (૧૪) રમેશ રંગાણી

એમ સર્વએ પોતાના મંતવ્ય આપેલ. પોતાના મંતવ્યમાં સર્વને નવા વર્ષની શુભેચ્છા આપેલ તેમજ સર્વનો આભાર માનેલ હતો.

ત્યારબાદ આભાર વિધી કા. સભ્ય રતિલાલ સેંઘાણીએ કરેલ. અને રાષ્ટ્રગીત ગાઈને આજની સભા પૂર્ણ જાહેર કરેલ.

ત્યારબાદ રાતના ૮.૦૦ કલાકથી ૧૦.૦૦ કલાક સુધી સમાજના તમામ ભાઈ-બહેનો દ્વારા રાસ-ગરબાનો કાર્યક્રમ યોજ હતો જેનો સર્વએ લાભ લીધો હતો અને રાતના મહાપ્રસાદ લઈને સહુ છુટા પડયા હતા.

લી. પ્રમુખ - શ્રી શાંતિભાઈ લાલજી ઘોળુ
મહામંત્રી - શ્રી વસંત રવજી પોકાર

શ્રી પાટીદાર યુવક મંડળ (મુંબઈ) દ્વારા
+ રાહત દરે મેડીકલ ચેકઅપ +

સર્વે જ્ઞાતિજનોને જણાવતા આનંદ થાય છે કે મોંઘવારીના જમાનામાં મેડીકલ ક્ષેત્રે અમો આપને મદદરૂપ થવા માંગીએ છીએ.

આ પ્રયત્ન રૂપે ફોર્ટીસ હોસ્પીટલ (મુલુંડ) સાથે ફક્ત આપણા જ્ઞાતિજનો માટે રાહતના દરે સંપૂર્ણ બોડી ચેકઅપના બે પેકેજ નક્કી કરવામાં આવેલ છે. જેની મુદત ૩૧ ઓકટોબર ૨૦૧૨ સુધીની છે. માટે નીરાસા ન સાંપડે તે માટે જલ્દી નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરશોજી.

ઘાટકોપર	મુલુંડ	મુલુંડ	બોરીવલી	ડોંબિવલી
રાજેશ પી. વેલાણી	શાંતિલાલ એન. ભાવાણી	જતીન એચ. પરવાડીયા	રમેશ એચ. વાસાણી	ડૉ. કોશીક બી. પોકાર
Cell : 9820418587	Cell : 9322261351	Cell : 9819199080	Cell : 9324619243	Cell : 9702087087

HEALTH MANAGEMENT

REGULAR PACKAGE ₹ ~~7950/-~~
FOR OUR SAMAJ ₹ 4000/- ✔

DIABETIC EVALUTION
- FASTING BLOOD SUGAR
- POST PARANDIAL SUGAR
- GLYCOSYLATED HEMOGLOBIN

CARDIAC RISK EVALUATION
- ECG
- STREES TEST
- 2D ECHO

LIPID PROFILE
- CHOLESTEROL
- HDL CHOLESTEROL
- TRIGLYCERIDES
- CHOLESTEROL/HDL RATION
- APOLIPOPROTEIN A1
- APOLIPOPROTEIN B
- APO A1 / APO B RATION

LIVER PROFILE
- BILIRUBIN
- SGPT
- SGOT
- GAMMA GT
- TOTAL PROTIEN
- ALBUMIN
- ALBUMIN/GLOBULIN RATION
- ALKALINE PHOSPHATASE

KIDNEY PROFILE
- CREATINIE
- BUN
- URIC ACID
- SERUM CALCIUM
- SERUM PHOSPHOURS

CONSULTATIONS
- PHYSICIAN
- GYNAECOLOGIST
- OPTHALMIC

GENERAL INVESTIGATIONS
- COMPLETE BLOOD COUNT WITH ESR
- BLOOD GROUP
- HBSAG (MAKER FOR HEPATITS B)
- PSA (FOR MEN)
- SERUM ELECTROLYTES
- URINE ROUTINE
- STOOL ROUTINE
- PAP SMEAR (FOR WOMEN)
- CHEST X RAY
- USG ABDOMEN WITH PELVIS
- PULMONARY FUNCTION TEST

MASTER HEALTH

REGULAR PACKAGE ₹ ~~5200/-~~
FOR OUR SAMAJ ₹ 2500/- ✔

DIABETIC EVALUTION
- FASTING BLOOD SUGAR
- POST PARANDIAL SUGAR

CARDIAC RISK EVALUATION
- ECG
- STREES TEST

LIPID PROFILE
- CHOLESTROL
- HDL CHOLESTROL
- TRIGLYCERIDES
- CHOLESTROL/HDL RATION

LIVER PROFILE
- BILIRUBIN
- SGPT
- SGOT
- GAMMA GT
- TOTAL PROTIEN
- ALBUMIN
- ALBUMIN/GLOBULIN RATIO
- ALKALINE PHOSPHATASE

KIDNEY PROFILE
- CREATINIE
- BUN
- URIC ACID
- SERUM CALCIUM
- SERUM PHOSPHORUS

CONSULTATIONS
- PHYSICIAN

GENERAL INVESTIGATIONS
- COMPLETE BLOOD COUNT WITH ESR
- BLOOD GROUP
- SERUM ELECTROLYTES
- URINE ROUTINE
- CHEST X RAY
- USG ABDOMEN WITH PELVIS
- PULMONARY FUNCTION TEST

નોંધ : ૧) ચેકઅપ માટે આવેલ વ્યક્તિની નાસ્તાની વ્યવસ્થા નીઃશુલ્ક કરવામાં આવેલ છે.
૨) બોડી ચેકઅપના રિપોર્ટ ત્યારબાદ તમારા ઘર પર કુરીયર દ્વારા મોકલવામાં આવશે.

લી. શ્રી પાટીદાર યુવક મંડળ - મુંબઈ

કચ્છ કડવા પાટીદાર સમાજ મલાડનો અહેવાલ અને સ્નેહમિલન

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મલાડ મુંબઈનું સ્નેહ મીલન અને સામાન્ય સભા તા. ૧૬-૧૧-૨૦૧૨ના પ્રમુખશ્રી સામજી નારણ નાકરાણીના અધ્યક્ષ સ્થાને પાટીદાર વાડી બોરીવલી મધ્યે મળેલ તેમા રૂટીન મુજબ વાર્ષિક અહેવાલ, સરસ્વતિ સન્માન, પ્રમુખ સ્થાનેથી અને કારોબારીની મુદત પુરી થતા મહામંત્રી શ્રી હિરાલાલ માવજી સેંઘાણીએ સામાન્ય સભાને જણાવ્યુ અને અભિપ્રાય માંગ્યો ત્યારે રમણિકભાઈ ભાદાણીએ આવતી એક ટર્મ માટે આ કારોબારીને પુન વરણી કરવાનું સુચન કરેલ તેને રમેશ રવજી પોકાર, ભરતભાઈ કે. લીમાણી અને કરસન મનજી પોકારે અનુમોદન આપેલ ત્યારે સર્વાનુમતે પ્રમુખ તરીકે સામજીભાઈ નાકરાણી, મહામંત્રી તરીકે હિરાલાલભાઈ સેંઘાણીની પુનઃ વરણી કરવામાં આવેલ ત્યારે હિરાલાલભાઈએ રતનશીભાઈ નાકરાણી મણિલાલભાઈ પારસીયા, નરશીભાઈ વેલાણી અને ગોપાલભાઈ રામાણશીના નામનું સુચન કરેલ તેની સાથે મુરબ્બી સલાહકારમા નરશીભાઈ ભાવાણી અને શીવલાલભાઈ ભાદાણીને સર્વાનુમતે કારોબારીમા લેવામાં આવ્યા.

મધ્યાન ભોજન બાદ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન યુવક મંડળના પ્રમુખ શ્રી સુરેષભાઈ પોકાર અને મહામંત્રી શ્રી ભાવેશભાઈ નાકરાણી દ્વારા મહિલા મંડળના સહયોગે કરવામાં આવેલ.

કારોબારીની યાદી

પ્રમુખ	શ્રી સામજી નારણ નાકરાણી	ઉપપ્રમુખ	શ્રી હિરાલાલ વાલજી પારસીયા
મહામંત્રી	શ્રી હિરાલાલ માવજી સેંઘાણી	સહ મંત્રી	શ્રી રવિલાલ નારણ રામજીયાણી

ખજાનચી શ્રી મણિલાલ રામજી પોકાર

સભ્ય : શ્રી હિરાલાલ રવજી પોકાર, શ્રી રમેશ રવજી પોકાર, શ્રી ધનસુખ અપૈઈ નાકરાણી, શ્રી ગોપાલ મુળજી રામજીયાણી, શ્રી લાલજી રામજી પોકાર, શ્રી મનસુખ વાલજી રૂડાણી, શ્રી રતનશી નારણ નાકરાણી, શ્રી મણિલાલ વાલજી પારસીયા, શ્રી નરશી નાનજી વેલાણી, શ્રી ગોપાલ કાનજી રામાણી.

મુરબ્બી સલાહકારની યાદી

શ્રી શાન્તિલાલ ધનજી માકાણી, શ્રી ભરતભાઈ કે. લીમાણી, શ્રી રમણિક વીરજી ભાદાણી, શ્રી કરસન મનજી પોકાર, શ્રી કરસન વાલજી રૂડાણી, શ્રી કેશુભાઈ વી. પોકાર, શ્રી રવજી માધવજી ગોરાણી, શ્રી વેલજી શીવલાલ વેલાણી

લિ. મહામંત્રી શ્રી હિરાલાલ માવજી સેંઘાણી
પ્રમુખ શ્રી સામજી નારણ નાકરાણી

શ્રી વસઈ વિભાગ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજનું "વિજયા-દશમીનું સ્નેહ મીલન"

તા. ૨૪-૧૦-૧૨ના દશેરાનાં શુભદિવસે વિરાર-નાલાસોપારા, વસઈ, ત્રણેય ગામના આપણાં જ્ઞાતિજનોનું સ્નેહમીલન વસઈ મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજવામાં અવેલ.

આપણાં પ્રમુખશ્રી ગંગારામભાઈ પોકાર, ઉપપ્રમુખશ્રી ભવાનજીભાઈ નાકરાણી, મંત્રીશ્રી રમણીકભાઈ પોકાર તથા કારોબારીનાં સભ્યોશ્રી દીપ પ્રાગટય કરી સભાની મંગળ શરૂઆત કરી. વસઈની બહેનોએ સ્વાગત ગીત રજુ કરી સૌને આવકાર્યા. ત્યારબાદ આપણાં સામજનાં ભાઈ-બહેનો તથા બાળકોએ સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ રજુ કર્યો. પ્રમુખશ્રીએ આવેલ સર્વ જ્ઞાતિજનોનો ઉષ્માભર્યો આવકાર આપતાં સ્વાગત પ્રવચન કર્યું. મંત્રીશ્રી રમણીકભાઈ પોકારે સભાનું સંચાલન કર્યું. ત્યારબાદ સર્વ દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું. તેમજ આપણાં સમાજના ગ્રેજયુએટ થયેલ વિદ્યાર્થી, ૧૦માં ધોરણ તથા ૧૨ ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કરવામાં આવ્યું. મંત્રીશ્રી રમણીકભાઈ પોકારે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું "જુનાં જમાનાંમાં રાવણને માથા તો ૧૦ (દસ) હતાં અને અવગુણ ફક્ત એક અભીમાન જ હતું છતાં તેનો નાશ થયો હતો જ્યારે આજના યુગમાં આપણાં એક માથામાં દસ અવગુણ (કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, છળ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, આળસ) ભરાઈ ગયા છે. તેમાથી મુક્ત થવા સૌએ સારા કાર્યોમાં, ધાર્મિક કાર્યોમાં પોતાની શક્તિ લગાડવા મંત્રીશ્રીએ સૌને આગ્રહ પુર્વક અનુરોધ કર્યો તેમજ આપણાં સમાજની સ્થાપનાને ૨૫ પચીસ વર્ષ પુરા થવા આવ્યા છે તેની સારી રીતે ઉજવણી કરવા સૌનો સહકાર આપવા જણાવ્યું. સમાજની શરૂઆત સન ૧૯૮૯ થી આજ સુધી સમાજની પ્રગતી તથા ખુબજ ખંતથી સેવા કરનાર આજી-માજી હોદેદારો તથા કાર્યકરોની મંત્રીશ્રીએ હૃદય પુર્વક પ્રશંશા કરી. ત્યારબાદ સમાજનાં સભ્યોએ મંચ પરથી પોતાનાં વિચારો તથા સુચનો રજુ કર્યા. ઉપપ્રમુખ શ્રી ભવાનજીભાઈ નાકરાણીએ "સમાજ વાડી" વહેલી તકે બનાવવા સૌને જણાવ્યું. ત્યારબાદ પ્રમુખ શ્રી ગંગારામભાઈ પોકારે સમાજને ઉપયોગી કાર્યો કરવા, એકતા જાળવવા તથા સૌની પ્રગતિ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી સમાજની મહિલા મંડળ તરફથી હરીદ્વારની તીર્થયાત્રા બહેનોને કરાવવા બદ સૌને ધન્યવાદ આપ્યા તેમજ શરદપુનમ બાદ "અષ્ટવિનાયક" યાત્રાનું આયોજન સમાજ તરફથી કરવામાં આવ્યું તે બદલ આનંદ વ્યક્ત કર્યો. સમાજ દ્વારા આવા શુભકાર્યો થતાં રહે તેવી આશા વ્યક્ત કરી. ત્યારબાદ રમેશભાઈ પોકારે સૌનો આભાર માન્યો. સૌએ પ્રેમપુર્વક પ્રિતિભોજનનો આનંદ માણ્યો અને પ્રોગ્રામ પુણ થયો.

લિ. વસઈ વિભાગ કચ્છ કડવા પાટીદાર સમાજ
મહામંત્રી શ્રી રમણીકભાઈ પોકાર

કલહ માનવના જીવનને ઉજ્જળ બનાવે છે, સુલેહ માનવના જીવનને ઉજવળ બનાવે છે.

realpatidar.com

https://archive.org/details/bk923/page/n4/mode/1up

2012-12-15 -Patidar Pragati -Mumbai Zone Aheval (923)

realpatidar.com

શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન સમાજ (મુલુંડ) મુંબઈ દ્વારા યોજેલ સ્નેહમીલન સમારોહ

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મુલુન્ડનું વાર્ષિક સ્નેહમીલન તેમજ સમુહભોજન તા. ૨૪-૧૧-૨૦૧૨, શનિવારે રોજે સંપુર્ણ દિવસીય સમારોહ પ્રમુખ શ્રી ધનજી શીવગણ રૂડાણીના અધ્યક્ષ સ્થાનેથી યોજાયેલ હતો.

સ્થાનીક સમાજનાં પ્રમુખ, મહામંત્રી તેમજ વડીલો દ્વારા દિપ પ્રાગટ્ય અને આરતી કરી પ્રારંભ કર્યા બાદ, સ્થાનિક મહિલા મંડળ દ્વારા યોજેલ સાંસ્કૃતિક કાર્યક્રમ સર્વે જ્ઞાતીજનોએ રસપુર્વક માણેલ હતો. બપોરે ભોજન પછીના સત્રમાં સમારોહના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલ હતું. ત્યારબાદ પ્રમુખશ્રી ધનજી શીવગણ રૂડાણી તેમજ મહામંત્રી શ્રી કેશવજી દામજી લીંબાણી તથા સભ્યો દ્વારા નવા વર્ષની શુભકામના તેમજ સમારોહ સંદર્ભે પોતાના આંતરિક મંતવ્ય વ્યક્ત કરેલ હતા અને મા ઉમિયાની જય બોલાવી પુર્ણ કરેલ હતી.

ત્યારબાદ સ્થાનિક યુવા મંડળ દ્વારા વ્યવસાયિક વ્યક્તિના સથવારે કોમેડિયન શો, ગેમ ઈવેન્ટ અને રાસ-ગરબાના રાખેલ આયોજનમાં સર્વે જ્ઞાતિજનોએ ભાગ લઈ ખુબજ હર્ષથી વધાવ્યા બાદ સૌ જ્ઞાતીજનો રાત્રી મહાપ્રસાદ લઈને છુટા પડયા હતા.

લિ. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મુલુંડ, મુંબઈ

કચ્છ કડવા પાટીદાર બોરીવલી સમાજનું સ્નેહ મિલન અને સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ

તા. ૧૭/૧૧/૨૦૧૨ના શુભ દિવસે બોરીવલી સમાજના આપણા જ્ઞાતીજનોનું સ્નેહ મિલન પાટીદાર સમાજ વાડી બોરીવલી મુકામે યોજવામાં આવેલ.

આપણા પ્રમુખશ્રી હંસરાજભાઈ વાસાણી, ઉપપ્રમુખ શ્રી તથા મંત્રીશ્રી હિરાલાલભાઈ રામજીયાણી તથા કારોબારીના સભ્યોશ્રીએ દીપ પ્રાગટ્ય કરી સભાની મંગળ શરૂઆત કરી. ત્યારબાદ બહેનોએ સ્વાગત ગીત રજુ કર્યું. ત્યારબાદ મંત્રીશ્રી હિરાલાલભાઈએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા. સભાનું સંચાલન મંત્રીશ્રી હિરાભાઈ રામજીયાણીએ કર્યું હતું. ગ્રેજ્યુએટ તથા ઉર્ત્તીણ થયેલા સર્વ વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માન કરવામાં આવેલ હતું. ત્યારબાદ ભાઈબહેનોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, ત્યારબાદ અત્યારે ચાલતી ગતીવિધિ પ્રમાણે ચર્ચા-વિચારણા તથા લોકોના મંતવ્યો જાણ્યા. સર્વની એકજ ભાવના હતી સમાજમાં એકતા જળવાઈ જોઈએ એવુ પ્રમુખશ્રીએ જણાવ્યું તેમજ જેન્તીભાઈ પરવાડીયાએ પોતાના વિચારો રજુ કર્યા અને સમાજના અંદર સંગઠન અને એકતા જળવાઈ રહે એવી સર્વ જ્ઞાતીજનોને અપીલ કરી ત્યારબાદ બપોરનું તેમજ સાંજનું સર્વ જ્ઞાતીજનોએ પ્રિતી ભોજનનો આનંદ માણ્યો અને છેલ્લે મંત્રી હિરાલાલભાઈ રામજીયાણીએ સર્વનો આભારમાની પ્રોગ્રામ પુર્ણ કરવામાં આવ્યો. આ પ્રોગ્રામમાં મહીલા મંડળના પ્રમુખશ્રી વનીતા બહેન છાભૈયા તેમજ તેમના કારોબારી મંડળ તેમજ યુવક મંડળના પ્રમુખશ્રી સતીષભાઈ તથા તેમના કારોબરી મંડળ સર્વે મળીને પ્રોગ્રામ બહુ સરસ રીતે ઉજવેલ.

લિ. પ્રમુખ - હંસરાજ અરજણ વાસાણી
મહામંત્રી-હીરાલાલ માવજી રામજીયાણી

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મીરારોડ મુંબઈ

સમાજના નવા કરણ ધારો જેના ઉપર સમાજનું જનમાણસ વિશ્વાસની દોર સોપરત કરે છે તેવા મહાનુંભવોની નામાવલી નીચે મુજબ છે.

પ્રમુખ	શ્રીમાન શાંતીલાલ લક્ષ્મણ છાભૈયા	(રાયણ મોટી)
મહામંત્રી	શ્રીમાન હરેશ હીરાલાલ પોકાર	(બીદડા)
ઉપપ્રમુખ	શ્રીમાન હીરાલાલ હંસરાજ પોકાર	(બીદડા)
ઉપપ્રમુખ	શ્રીમાન દીનેશ નથુ રંગાણી	(ગઢસીસા)
સહ મંત્રી	શ્રીમાન ભરત કલયાણજી છાભૈયા	(રાયણમોટી)
સહ મંત્રી	શ્રીમાન રવિલાલ લક્ષ્મણ છાભૈયા	(રાયણમોટી)
ખજાનચી	શ્રીમાન ધીરજલાલ રતનશી લીંબાણી	(ગઢસીસા)
સહ ખજાનચી	શ્રીમાન હરેશ નારણ પરવાડીયા	(ગઢસીસા)
સભ્ય	શ્રીમાન લખમશી મનજી માવાણી	(રતનાપર)
	શ્રીમાન હરેશ નારણ સુરાણી	(ગુજરાત)
	શ્રીમાન પ્રસાંત હસમુખ છાભૈયા	(રાયણ મોટી)

સાથ... સહકાર... તેમજ સંગઠન...ની ભાવના રાખનાર એટલે જ મીરારોડનું આગણું.

લિ. મહામંત્રી
શ્રીમાન હરેશ હીરાલાલ પોકાર - (બીદડા)

શ્રી અ.ભા.ક.ક. પાટીદાર સમાજ-મુંબઈ ઝોનની તા. ૧-૧૨-૨૦૧૨ મળેલ સામાન્ય સભાનો અહેવાલ

શ્રી અ.ભા.ક.ક. પાટીદાર સમાજ મુંબઈ ઝોનની સામાન્યસભા તા. ૧-૧૨-૨૦૧૨ના બપોરના ૩.૩૦ કલાકે ઘાટકોપર પાટીદારવાડીમાં મુંબઈ ઝોનના પ્રમુખ શ્રી છગન કાનજી પોકારના અધ્યક્ષ સ્થાને મળેલ તેમાં કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલા તેમજ ઉ.પ્રમુખ શ્રીઓ તેમજ ટ્રસ્ટીશ્રીઓ હાજર રહેલ હતા.

સૌ પ્રથમ સમાજના મંત્રીશ્રી નરસિંહ સામજી સેંઘાણીએ ઉમિયા માતાજીની જય ઘોષ સાથે મંચ પર મુંબઈ ઝોનના હોદ્દેદારો, કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલા તેમજ કેન્દ્રીય સમાજના હોદ્દેદારો, વિવિધ સંસ્થાનના પદાધિકારીઓને સ્થાન અપાવેલ અને મા ઉમિયાની છબી પાસે દીપ પ્રાગટય કરી આર્શિવાદ મેળવેલ.

મુંબઈ ઝોનના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ લીંબાણીએ સભામાં ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનોનું ઉષ્માભર્યું શાબ્દીક સ્વાગત કરેલ.

કેન્દ્રીય સમાજથી આવેલ સર્વે હોદ્દેદારોનું મુંબઈ ઝોનના હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનીત કરવામાં આવેલ.

ત્યારબાદ મુંબઈ ઝોનના મહામંત્રી શ્રી ઉમેશભાઈ નાથાણીએ એજેન્ડા અનુસાર ગત તા. ૩૧-૭-૨૦૧૧ ની સામાન્ય સભાની મીટીંગની મિનીટ્સનું વાંચન મંત્રી શ્રી નરસિંહભાઈ સેંઘાણીને અનુરોધ કરેલ, મીનીટસનું વાંચન કર્યાબાદ સર્વાનુમત્તે પ્રમુખશ્રીની સહી કરીને બહાલ કરવામાં આવેલ.

ત્યારબાદ પ્રમુખશ્રીની મંજુરીથી શ્રી કાન્તીલાલ નારણ સેંઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે વર્તમાન સંજોગોમાં ચર્ચીત માંડવી હોસ્ટેલ નિર્માણ સમિતિ બાબતમાં કેન્દ્રીય સમાજના હોદ્દેદારો તેમજ નિર્માણ સમિતિના હોદ્દેદારો સાથે બેસીને આપણે સમાજના હીતમાં સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીઓ, મુંબઈ ઝોનના પ્રમુખ શ્રી છગનભાઈ પોકાર, તેમજ ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી રવિલાલ કેશરા રામજીયાણી અને સર્વે મહાનુભવોની વચ્ચે નક્કી કરવામાં આવેલ અને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના બની રહે તેથી આજની સભામાં જુનુ બધુ ભુલીજઈ નવી શરૂવાત કરવાની છે અને માંડવીનો પ્રશ્ન આ સભામાં હવે ચર્ચા કરવાની જરૂરત નથી અને આજની મીટીંગ શાંતિપૂર્ણ પુરી કરવા અપીલ કરેલ હતી.

ઉપરોક્ત વિષયપર શ્રી રમેશભાઈ પોકાર, શ્રી મનસુખભાઈ વેલાણી, બાબુભાઈ સેંઘાણી, રમેશભાઈ રંગાણી, સર્વેનો એકજ સુર કે જુનુ ભુલી જઈ નવી શરૂવાત કરીએ, સંગઠન જળવાઈ રહે અને મુંબઈ ઝોનના એરિયા શિવાયની ચર્ચા કરીને મુંબઈની એકતા, સંગઠન તોડવાનો કોઈ અર્થ નથી તેથી જ સભાને પૂર્ણતા તરફ લઈ જાઓ એની દરેકની અપીલ હતી.

ઉપરોક્ત અપીલને ધ્યાનમાં લેતા નક્કી કરેલ એજેન્ડા સ્થગિત કરી પ્રથમ કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલા એ પોતાના વકતવ્યમાં જણાવેલ કે અમો અહી માંડવી નિર્માણ સમિતિની ચર્ચા કરવા આવ્યા નથી. મુંબઈમાં ઘર્ષણ ઉભી થાય એમ અમો નથી ઈચ્છા. અમોએ દરેક ઝોનની મુલાકાત લઈ રહ્યા છીએ અને અત્યાર સુધી ૧૧ ઝોનની મુલાકાત લીધેલ છે. અને આજે બારમાં મુંબઈ ઝોનની મુલાકાત લઈ રહ્યા છીએ. આગળ જણાવેલ કે કેન્દ્રીય સમાજના નિતિ નીયમો છે તે સંસ્થા સાથે જોડાયેલા સભ્યોને તે પાળવી પડશે. કોઈ પણ વિષય પર મતભેદ હોય તો કેન્દ્રીય સમાજની સામાન્યસભામાં રજુ કરો અને બહુમતી અથવા સર્વાનુમતેથી જે નિર્ણય લઈએ તે પાળવા પડશે. સાથે સાથે પાટીદાર દર્શનવાળા જેન્તીભાઈ પારસીયાને ટકોર કરેલ કે કેન્દ્રીય સમાજ વિરુદ્ધ ખોટો પ્રચાર કરતા પહેલા મારી પાસે આવીને ખુલાસાઓ જાણી અને એ ખુલાસાઓ પણ જાહેર કરજો. અંતમાં પ્રમુખશ્રીએ જણાવેલ કે તમોએ મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આભાર માનેલ અને મારે આજે ઘણી ચર્ચા કરવાની હતી તે હવે હુ લેખીતમાં જણાવીશ એમ કહી પોતાનું વક્તવ્ય પુર્ણ કરેલ હતું.

ત્યારબાદ મુંબઈ ઝોનના પ્રમુખ શ્રી છગન કાનજી પોકાર પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવેલ કે આજની સભામાં કેન્દ્રી સમાજના હોદ્દેદારોને આપણે સાંભળ્યા અને તે પ્રમાણે સમાજની એકતા અને સંગઠનની ભાવના બની રહે તે માટે આપણે સૌ કટીબદ્ધ છીએ અને આવેલ સર્વે જ્ઞાતિજનોનો આભાર માનેલ અને મીટીંગ પૂર્ણ કર્યાબાદ મહાપ્રસાદ લઈને જશો એ સાથે મા ઉમીયાની જય બોલાવી પોતાનું વક્તવ્ય પૂર્ણ કરેલ.

અને છેલ્લે આભારવિધિ મુંબઈ ઝોનના શ્રી હિરાલાલ માવજી સેંઘાણીએ કરી રાષ્ટ્રગીત ગાઈ મા ઉમિયાની જય બોલાવી મીટીંગ પૂર્ણ જાહેર કરેલ.

લિ.

છગનભાઈ કાનજી પોકાર	ઉમેશ ડાહ્યાલાલ નાથાણી
પ્રમુશ્રી - મુંબઈ ઝોન	મહામંત્રી - મુંબઈ ઝોન

ધરતીકંપ કરતાં માનવ માનવ વચ્ચેનો, ધિક્કારકંપ ભયાનક હોનારત સર્જે છે.

realpatidar.com

https://archive.org/details/bk923/page/n5/mode/1up

2012-12-15 -Patidar Pragati -Mumbai Zone Aheval (923)

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર એકતા મંચની રચના

હાલમાંજ મુંબઈમાં મુંબઈ એરિયા શિવાયના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા મીટીંગો "મુંબઈ ઝોન" મારફતે લેવામાં આવેલ હતી, તેથી મુંબઈની એકતા તુટવાના એંધાણ દેખાતા, અમુક જાગૃત ભાઈઓના મનમાં એક એકતા મંચ રચવાના વિચારો આવેલ તેને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ટ્રસ્ટ ફંડ મુંબઈના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને, મુંબઈમાં સંપ, સંગઠન જળવાઈ રહે, તેથી મુંબઈમાં એકતા મંચની રચના કરવા મીટીંગ લઈને એક "કચ્છ કડવા પાટીદાર એકતા મંચ (મુંબઈ)"ની રચના કરવામાં આવેલ છે. તેમાં મુંબઈમાં વસતા દરેક ભાઈ-બહેનો સાથ સહકાર આપે તેવી વિનંતિ કરવામાં આવે છે. તદઉપરાંત પરાની સમાજો, યુવક મંડળો, મહિલા મંડળો પણ એકતા મંચમાં જોડાઈને સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખવામાં આવે છે. સંપર્ક કરવા માટે નીચેની વ્યક્તિ ઓનો સંપર્ક કરે.

શ્રી મનસુખ ધનજી વેલાણી	૯૮૯૨૧૩૫૧૩૪
શ્રી સામજી નારાયણ નાકરાણી	૯૩૨૨૨૯૯૬૪૫
શ્રી નવીન ડાહ્યાભાઈ ઘોળું	૯૮૬૭૭૪૮૦૭૮
શ્રી મોહન કરસન પોકાર	૯૩૨૨૨૬૧૩૪૭
શ્રી જગદીશ કાનજી ભાકાણી	૯૮૬૭૬૨૯૧૬૪
શ્રી અરવિંદ શીવજી પોકાર	૯૮૬૯૪૭૩૭૬૨
શ્રી શીવલાલ લખમશી વાસાણી	૯૮૨૦૮૨૭૪૮૪

શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજીત કાર્યક્રમ "ઘરગુથ્થી બનાવી શકાય એવી વસ્તુઓનું ડેમોસ્ટ્રેસન"

ખુશ ખબર ! ખુશ ખબર ! ખુશ ખબર !

રોજ બરોજની જીવન જરૂરીયાતની વસ્તુઓ જેવી કે શેમ્પુ, સાબુ, હર્બલ ચા, પરફ્યુમ, પાવડર, મીણબત્તી વગેરે આ બધીજ વસ્તુઓ આપણે ઘરે બનાવતા શીખીએ અને આપણા જ પૈસાની બચત કરવાની તક ઝડપી લઈએ.

તો આવો આવી સોનેરી તકને ઝડપી લેવાનો કાર્યક્રમ લઈને આવી રહ્યું છે મહિલા મંડળ (મુંબઈ)

સોમવાર, તા. ૭/૧/૨૦૧૩, સમય : ૧.૦૦ થી ૫.૦૦ કલાકે
સ્થળ : ઘાટકોપર વાડી, શુલ્ક : રૂા. ૨૦/-

કોન્ટેક નંબર : શીલા ૯૮૧૯૪૧૦૫૨૩ દક્ષા ૯૯૬૭૯૯૧૬૬૪
જ્યોતિ ૯૮૭૦૩૬૧૮૫૮ ઉર્મિલા ૯૯૮૭૪૩૪૨૪૫

ખાસ નોંધ : મહિલા મંડળ મુંબઈની મંથલી મીટીંગ તારીખ ૧/૧/૨૦૧૩ના બદલે ૨/૧/૨૦૧૩ બુધવારે બપોરે ૨.૩૦ કલાકે રાખવામાં આવી છે તેની સર્વે બહેનો ખાસ નોંધ લે.

લિ. પ્રમુખ - શ્રીમતી રશ્મિ ચૌહાણ
મહામંત્રી - વર્ષા નરેશ દિવાણી

શ્રી પાટીદાર યુવક મંડળ (મુંબઈ)ની વાર્ષિક સામાન્ય સભા

શ્રી પાટીદાર યુવક મંડળ (મુંબઈ)ની વાર્ષિક સામાન્ય સભા તારીખ ૨૬, જાન્યુઆરી, ૨૦૧૩, શનિવારના રોજ બપોરે ૩.૩૦ કલાકે ઘાટકોપર પાટીદાર વાડી ખાતે બોલાવેલ છે. જેમાં સર્વે ભાઈ-બહેનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ છે. મીટીંગના એજન્ડા નીચે મુજબ છે.

એજન્ડા :-

૧. ગત મીટીંગની મીનીટસનું વાંચન અને બહાલી.
૨. ગત વર્ષ ૨૦૧૧-૨૦૧૨ન વાર્ષિક હીસાબોનું રજુઆત.
૩. પ્રમુખ સ્થાનેથી જે રજુઆત થાય તે.

લિ. શ્રી પાટીદાર યુવક મંડળ (મુંબઈ)

ઉમિયા કપ-૨૦૧૩

રમત ગમતોની મોસમ ચાલુ થઈ ગઈ છે તો સાથે જ આપણા જ્ઞાતિજનોને જણાવતા આનંદ થાય છે કે શ્રી પાટીદાર યુવક મંડળ (મુંબઈ) દ્વારા આયોજીત ઉમિયા કપ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આ વખતે તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ કરેલ છે. જેનું સ્થળ છે ઠાકુર ગ્રાઉન્ડ, કાંદીવલી. પ્રવેશ ફી, ફોર્મ મેળવવાની તેમજ ભરવાની તારીખો, ટીમો સાથે મીટીંગોની તારીખો વગેરે વિગતો આગામી અંકમાં આપવામાં આવશે.

લિ. શ્રી પાટીદાર યુવક મંડળ (મુંબઈ)

શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ ઘાટકોપર દ્વારા આયોજીત "આયુર્વેદિક પંચ કર્મ પદ્ધતિ"

શ્રી કચ્છી કડવા પાટીદાર મહિલા મંડળ ઘાટકોપર દ્વારા આપણી જ સમાજની બહેન શ્રીમતિ કમળાબેન ઉકાણી દ્વારા આયુર્વેદિક પંચકર્મ પદ્ધતિ જેમાં નેત્રા બસ્તિ, ધ્યાન બસ્તિ, શિરોધરા, ફૂટ મસાજ, તે ઉપરાંત ઘરે ત્વચાને લગતા જેલ બનાવવા.

બજારમાં મળતા નકલી જેલ ક્રીમ ને ટેસ્ટ કેવી રીતે કરવું તેની જાણકારી આપશે. સમય : બપોરે ૨.૩૦ થી ૫.૦૦

આ પ્રોગ્રામમા એન્ટ્રી લેવામાટે રૂા. ૨૦/- ભરીને આવવાનું રહેશે.

લિ. પ્રમુખ શ્રીમતિ દિપિકાબેન વેલાણી
મંત્રી - શ્રીમતિ વસીલા સેંઘાણી

શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ (ઘાટકોપર) આયોજીત પરિવાર કપ-૨૦૧૩

ઘાટકોપરમાં વસતા જ્ઞાતીજનોને જણાવતા આનંદ થાય છે કે આગામી તારીખ ૨૩ અને ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩ના મંડળ દ્વારા સ્વ. બાબુલાલ હીરજી ચૌહાણ વિનર્સ ટ્રોફી પરિવાર કપનું ફાતીમા હાઈસ્કુલ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા સર્વે જ્ઞાતીજનોને હાર્દીક આમંત્રણ છે. ટીમોએ તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધી નીચે જણાવેલ સભ્યો પાસે રજીસ્ટ્રેશન કરાવવું.

૧)	હીતેશ હીરાલાલ રામજીયાણી	૯૮૬૯૯૮૭૩૪૭
૨)	પ્રદીપ પુરષોત્તમ વેલાણી	૯૮૬૭૩૩૨૨૮૭
૩)	સત્યેન મોહન વેલાણી	૯૮૧૯૩૫૩૫૪૧

લી. મહામંત્રી - રાજેશ પ્રભુલાલ વેલાણી

॥ શ્રી ગણેશાય નમઃ ॥

શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજ નાલાસોપારા (મુંબઈ)

શ્રી કૃષ્ણાયોગેશ્વર મા ઉમીયાધામ: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

શુભારંભ : બુધવાર, તા. ૨૬-૧૨-૨૦૧૨
પુર્ણાહુતી : શુક્રવાર, તા. ૨૮-૧૨-૨૦૧૨

પરમ કૃપાળુ પરમાત્મા અને મા ઉમીયાની અસીમ કૃપાથી શ્રી કૃષ્ણ અને મા ઉમીયા માતાજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનું શુભ પ્રારંભ તા. ૨૬-૧૨-૨૦૧૨ થી ૨૮-૧૨-૨૦૧૨ના નીરધાર કરેલ છે, તો સર્વે ભાવિકોને ભાવ ભર્યું આમંત્રણ આપતા હરખની લાગણી અનુભવિયે છીયે. તો આપ સર્વે મહાનુંભવો આ પ્રભુના પટાંગણમા આવી શોભામાં અભીવૃધ્ધી કરશોજી

મહોત્સવના આચાર્ય પદે

પ.પુ. શ્રી ભુપેન્દ્ર કે પુરોહીત (રોહીસાવાળા)

બીરાજમાન થશે.

-: આયોજક :-

શ્રીમાન ગંગારામ જીવરાજ પોકાર પરિવાર
શ્રી કૃષ્ણ યોગેશ્વર મા ઉમીયા ધામ ટ્રસ્ટ

-: શુભ સ્થળ :-

શ્રી કૃષ્ણયોગેશ્વર મા ઉમીયાધામ ટ્રસ્ટ
શ્રી યોગેશ્વર નગર, તુલનીજ, નાલાસોપારા (પૂર્વ), જી. થાણા, પીન કોડ-૪૦૧ ૨૦૯.

Printed and Published by : Chhagan Kanji Pokar on behalf of Shree Kutcchi Kadva Patidar Gnyati Trust Fund, Mumbai and Printed at : M/s. Jyoti Print & Pack Pvt. Ltd., 114/A, Ghatkopar Industrial Estate, Amrut Nagar, Ghatkopar (W), Mumbai - 400 086. Published at : Shree Kutcchi Kadva Patidar Gnyati Trust Fund, Patidar Wadi, Near Hotel Airways, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai - 400 086. Editor : Shri Narayan Vishram Bhagat